

ત્વરિત જાહેરાત માટે

કેનેડાની સરકાર અને FCM તરફથી બ્રમ્પટન ટ્રાન્ઝિટ માટે CUTRIC પ્રાપ્ત કરે છે \$175 હજારનું રોકાણ.

બ્રમ્પટન, ઓન્ટારિયો (05 જુલાઈ 2022) – આજે માનનીય જોનાથન વિક્લિન્સન, કુદરતી સંસાધનોના મંત્રી; હાલ્ટન રિજનના કાઉન્સિલર અને ફેડરેશન ઓફ કેનેડિયન મ્યુનિસિપાલિટીઝ (FCM)ના બોર્ડ સભ્ય રોરી નિસાન, અને બ્રમ્પટનના ડેપ્યુટી મેયર અને રિજનલ કાઉન્સિલર માર્ટિન મેડિરોસ, બર્લિંગ્ટનના મેયર મેરિએન મીડ વોર્ડ, અને કેનેડિયન અર્બન ટ્રાન્ઝિટ રિસર્ચ એન્ડ ઇનોવેશન કન્સોર્ટિયમ (CUTRIC)ના પ્રમુખ અને સીઈઓ જોસિપા પેટ્રુનિચ વતી સાંસદ રૂબી સાલોટાએ FCMના ગ્રીન મ્યુનિસિપલ ફંડ (GMF)ના માધ્યમથી બ્રમ્પટનમાં ટ્રાન્ઝિટ માટે થનાર રોકાણની જાહેરાત કરી હતી.

ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના સિટી ઓફ બ્રમ્પટનના વ્યૂહાત્મક પ્રયાસોને ટેકો આપવા અને જાહેર પરિવહન માટેની ભાવિ સંઘર્ષશીલ માંગને પહોંચી વળવા માટે CUTRICને ફિઝિબિલિટી અભ્યાસ માટે \$175,000 પ્રાપ્ત થયા છે. અભ્યાસનું ધ્યાન બ્રમ્પટન ટ્રાન્ઝિટના રૂટના નેટવર્ક પર શૂન્ય ટેલપાઈપ-ઉત્સર્જન બસો (ZEBs) નો ઉપયોગ કરવાની શક્યતાની આકારણી પર કેન્દ્રિત છે.

અભ્યાસ CUTRICના આંતરિક રીતે વિકસિત આગાહી માટેના મોડેલિંગ ટૂલ RoutΣ.i™ નો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી રહ્યો છે. આ ટૂલમાં હાલની ટેકનિકના આધારે ZEBs અથવા FCEBs અપનાવવાની શક્યતા અને ફાયદા નિર્ધારિત કરવા માટે રૂટના નક્શા, પરિવહન સમયપત્રક, હવામાન અને મુસાફર-લોડિંગ જેવી પ્રચલનીય પરિસ્થિતિઓ સામેલ છે.

વિદ્યુત ZEB બસ કાફલામાં થનાર સંક્રમણ શહેરની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ગ્રીન સિટી બનાવવાની પ્રતિબદ્ધતાઓ પર આધારિત છે. ZEB ટકાઉ ટ્રાન્ઝિટ વાહનો છે જે સમુદાયના પરિવહનને કાર્યક્ષમ, શાંત અને સ્વચ્છ બનાવશે.

બ્રમ્પટનમાં ઉત્પન્ન થતા ગ્રીનહાઉસ ગેસ (GHGs)ના ઉત્સર્જનોને 2050 સુધીમાં 80 ટકા જેટલા ઘટાડવાનો મનસૂબો એટલે સિટીની ટ્રાન્ઝિટ બસોનું વિદ્યુતિકરણ કરવાનો પ્રવાસ છે જે એક વિશાળ સીમાચિહ્ન છે. હાલના 133 ડિઝલ ઇલેક્ટ્રિક હાયબ્રિડ ઝૂમ બસોના કાફલામાં ઉમેરો કરવા માટે બ્રમ્પટન ટ્રાન્ઝિટે પ્રથમ આઠ બેટરી ઇલેક્ટ્રિક ઝીરો એમિશન બસો અને ચાર ઉચ્ચ શક્તિ ઓવરહેડ ઓપોર્થ્યુનિટી ચાર્જરો 2021ના મે માસમાં દાખલ કર્યા હતાં. આખા કાફલાને ZEBs માં રૂપાંતરિત કરવાથી એવી ધારણા છે કે આશરે બસ દીઠ 115 ટન CO₂ (કાર્બન ડાયોક્સાઈડ)ની વર્ષ દીઠ બચત થશે એટલેકે એક વર્ષે કુલ 53,000 ટન GHGs, અથવા એમ કહી શકાય કે માર્ગો પરથી 12,000 પેસેન્જર વાહનો દૂર કર્યા ગણાય (GHGsના ટન પ્રમાણે).

FCM દ્વારા પ્રશાસિત GMFનું નીધિયન કેનેડા સરકારના એન્ડોમેન્ટના માધ્યમથી થાય છે. GMF સ્થાનિક સરકારોને ટકાઉ પ્રણાલિઓ શરૂ કરવામાં સહાય કરે છે. નીધિયન, સંસાધનો અને તાલીમના તેના અજોડ મિશ્રણથી નગરપાલિકાઓને એવા ટૂલ્સ હાથ લાગે છે જેની તેમને સ્થિતિસ્થાપકતા ઊભી કરવા અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનો ઘટાડવા માટે આવશ્યકતા હોય.

લિંક:

- [કેનેડા અને FCM, બ્રમ્પટનમાં અને બર્લિંગ્ટનમાં નિમ્ન ઉત્સર્જન ટ્રાન્ઝિટમાં રોકાણ કરશે](#)

સુવાક્યો

"સિટી ઓફ બ્રમ્પટનમાં ઝીરો-એમિશન બસો માટે CUTRICના ફિઝિબિલિટી અભ્યાસમાં તેમના રોકાણ માટે કેનેડાની સરકાર અને FCMનો મનઃપૂર્વક આભાર. આ \$175 લગ્નરત્નું રોકાણ બ્રમ્પટનમાં અને કેનેડામાં ટકાઉ ટ્રાન્ઝિટના આગામી સ્તરને સીધી સહાય કરશે કારણકે બ્રમ્પટન ટ્રાન્ઝિટ આગામી પાંચ વર્ષ દરમિયાન 450 જેટલી ઝીરો-એમિશન બસો ખરીદનાર છે. બ્રમ્પટન એક હરિત શહેર છે અને સાથે મળી અમે અમારા કાર્બન પદચિહ્ન ઘટાડીશું અને અમારા સમુદાયના જીવનની ગુણવત્તામાં સુધારો લાવીશું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"સિટી ઓફ બ્રમ્પટન કેનેડાની સરકાર, FCM અને CUTRIC જેવા તેમના સહયોગીઓ અને ટેકેદારો સાથે ટકાઉ, નિમ્ન કાર્બન જાહેર પરિવહનનું સ્વપ્ન જુએ છે. GMFના નીધિયનનો આભાર કે CUTRICનો ફિઝિબિલિટી અભ્યાસ સિટીને GHGના ઘટાડા, ખર્ચ સામેનો લાભ અને સમયપત્રક વિશ્લેષણ અંગેની ઊંડી સૂઝ કેળવવામાં મદદરૂપ થશે કે કઈ ઝીરો-ટેઈલપાઈપ એમિશન બસો આપણા બ્રમ્પટન ટ્રાન્ઝિટ નેટવર્કના પ્રત્યેક રૂટ માટે ઉચિત છે અને આપણા કાફલાના વિદ્યુતિકરણ માટે બીજા કયા મહત્વના પરિબળો છે."

- માર્ટિન મોડિરોસ, ડેપ્યુટી મેયર, વોર્ડ 3 અને 4, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટન શહેર સ્વચ્છ પરિવહન પહેલોનું નેતૃત્વ કરે છે અને અમે CUTRICના માધ્યમથી કેનેડાની સરકાર અને FCM દ્વારા થયેલ \$175 લગ્નરના રોકાણને આવકારીએ છીએ. બ્રમ્પટનને હરિયાળું શહેર બનાવવાની આ કાઉન્સિલની પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ભાગ એટલે ઝીરો-એમિશન બસો છે. બ્રમ્પટન ટ્રાન્ઝિટ માટે એક વધુ હરિયાળા ભવિષ્યને સમર્થન આપવા માટે અમારી ટીમ અને અમારા સહયોગીઓનો આભાર."

- પૉલ વિસેન્ટ, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

"FCMના બોર્ડ સભ્ય તરીકે, મને એવી અનેક ચર્ચાઓમાં ભાગ લેવાના અવસરો સાંપડ્યા કે કેવી રીતે હાલના કાફલાઓને શૂન્ય-ઉત્સર્જન અને લો-કાર્બન ટ્રાન્ઝિટ ટેકનોલોજીમાં સ્થાનાંતરિત કરવા સાથે સંકળાયેલ મુખ્ય પડકારો, તકો અને ઉકેલોને પૂર્ણ કરવા આખા કેનેડાની ટ્રાન્ઝિટ એજન્સીઓને સમર્થન આપવું. શૂન્ય-ઉત્સર્જન ટ્રાન્ઝિટના અભિયાનમાં બ્રમ્પટન મોખરે છે, અને તે ખરેખર અગત્યનું છે કે તમામ એવી એજન્સીઓ અને સરકારી વિભાગો જે આમાં સંડોવાયેલ હોય તેઓ સાથે મળીને હરિયાળા ટ્રાન્ઝિટ નેટવર્ક બનાવવાનું કાર્ય કરે."

- રોવેના સેન્ટોસ, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5, સીટી ઓફ બ્રમ્પટન; બોર્ડના સભ્ય, FCM

"બ્રમ્પટન સારી રીતે જોડાયેલ, ટકાઉ અને ઉર્જા-કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા અને તમામ લોકો માટે હરિયાળું શહેર બનાવવા પ્રતિબદ્ધ છે. સરકાર કેનેડા, FCM અને CUTRICને તેમની સહાય બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. અમે બ્રમ્પટનમાં નિવેશ લાવતા રહેવા માટે અમારા હિસ્સાધારકો સાથે કાર્ય કરતા રહીશું."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

"ટકાઉ પરિવહન વ્યવસ્થામાં બ્રેમ્પટન ટ્રાન્ઝિટ નેતૃત્વ સંભાળે છે અને ઝીરો-એમિશન એટલેકે શૂન્ય ઉત્સર્જન ધરાવતી બસો એટલે આપણા બસોના કાફલાના વિદ્યુતિકરણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો અગત્યનો ભાગ. અમારી વિદ્યુતિકરણ કરવાની પરિયોજનામાં રોકાણ લાવવા માટે અમે CUTRIC અને વિવિધ અન્ય હિસ્સાધારકો સાથે કાર્ય કરી રહ્યા છીએ અને અમે અમારા સહયોગીઓના આભારી છીએ કે અમે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે અમને એમનો સાથસહકાર મળી રહ્યો છે.

- એલેક્સ મિલોજેવિચ, જનરલ મેનેજર, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ, સિટી ઓફ બ્રેમ્પટન

"2015માં હું ચુંટાઈ આવી ત્યારથી મે નરી આંખે જોયું છે કે CUTRICએ સંક્રાંતિકાળથી નિમ્ન-ઉત્સર્જન ટ્રાન્ઝિટમાં કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ નીધિયન ક્ષણવણી તો અનેક પૈકી એક છે જે CUTRIC સાથેના સહયોગમાં સિટી ઓફ બ્રેમ્પટને મેળવી છે અને આ બધું જ્યારે અમે આપણા ભવિષ્યને વિદ્યુતિકરણથી સજાવી રહ્યા છે, પ્રદુષણ ઘટાડી રહ્યા છીએ અને સ્વચ્છ પરિવહનમાં નિવેશ કરી રહ્યા છીએ – જે આપણે સહુને નેટ-ઝીરો એમિશનના લક્ષ્યના હાથ વેંતના અંતરે લાવી રહ્યા છે.

- રૂબી સાહોટા, બ્રેમ્પટન નોર્થના સાંસદ

"બ્રેમ્પટન અને બર્લિંગ્ટન, ઓન્ટારિયોમાં સ્વચ્છ પરિવહન માટે નીધિયનની આજની જાહેરાત એટલે આપણી સરકારની કેનેડિયનો પ્રદુષણ ઘટાડે તે માટેની પ્રાથમિકતા તરફ જતું પગલું જેનાથી આપણા સમુદાયો વિકાસ જોશે અને સ્વચ્છ ટેકનોલોજીઓમાં આપણા ઈનોવેશનોને આગળ ધપાવશે. આ ક્ષેત્રમાં CUTRICના નેતૃત્વને સમર્થન આપતા કેનેડા સરકાર આનંદની લાગણી અનુભવે છે. તેમના નેતૃત્વ માટે હું એમને અભિનંદન પાઠવું છું"

- માનનીય જોનાથન વિલ્કિન્સન, કુદરતી સંસાધનોના મંત્રી

"હવામાન સામેની લડતમાં દરેક જાણ જોડાય તે અતિ મહત્ત્વનું છે. આ ખા કેનેડાની નગરપાલિકાઓ રોજગાર ઊભા કરવા અને હવામાનની સ્થિતિસ્થાપકતા માટે નવા નવા ઉકેલો શોધવા માટે પોત પોતાની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. કેનેડાના સમુદાયોમાં ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રોકાણોથી આપણી હવા વધુ શુદ્ધ થશે, આપણું અર્થતંત્ર વધુ મજબૂત બનશે અને આપણને નેટ-ઝીરો ઉત્સર્જનના માર્ગ પર લાવીને મુકશે.

- માનનીય સ્ટિવન ગીલબો (Steven Guilbeault), આબોહવા અને પર્યાવરણ બદલાવના મંત્રી

"માનવો આજના દિને મોટા ભાગે શહેરોમાં રહે છે. આબોહવા પરિવર્તનને સંબોધિત કરવા અને આબોહવા બદલાયેલા વિશ્વમાં આપણા ભાવિ માટે આયોજન કરવામાં શહેરોએ માર્ગ બનાવવો જોઈએ. બ્રેમ્પટન અને બર્લિંગ્ટન જેવા શહેરો સાથે કાર્ય કરવાનો CUTRICને ગૌરવ છે. આબોહવાને લગતી કાર્યવાહી સંબંધિત નવતર વિચારોના આ શહેરો, ઊભરતા કેન્દ્રો છે. દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન લાવવાનો અને નિમ્ન કાર્બન ગતિશીલતાના લેન્ડસ્કેપ માટેનો સમય હોય તો આ જ છે."

- જોસિપા પટ્ટનિચ, પ્રમુખ અને CEO, CUTRIC

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca

કુદરતી સંસાધનો કેનેડા

મિડિયા રિલેશન્સ (Media Relations)

343-292-6100

media@nrca-nrcan.gc.ca

ને Twitter પર ફોલો કરો: @NRCan (<http://twitter.com/nrcan>)

કીઅન નેમ્બહાર્ડ

પ્રેસ સેક્રેટરી

કુદરતી સંસાધનોનાં મંત્રીની કચેરી

613-323-7892

keean.nembhard@nrca-nrcan.gc.ca

FCM મિડિયા રિલેશન્સ

613-907-6395

media@fcm.ca